

Seat No. : _____

OC-130

October-2018

B.Sc., Sem.-VI

308 : Chemistry
(Inorganic)

Time : 2:30 Hours]

[Max. Marks : 70

1. (A) નીચે દર્શવિલ પદો માટે ટર્મ સંજ્ઞાઓ મેળવો :

14

- (a) F^{-1} ($Z = 9$) (b) Sc^{2+} ($Z = 21$)
(c) S ($Z = 16$) (d) Ni^{2+} ($Z = 28$)

અધ્યવા

- (i) d^2 રચના માટે પીજુઅન હોલ આકૃતિ દોરો તથા ટર્મ સંજ્ઞા તરફાં વાર્ષિક સમજાવો.
(ii) $[Cu(H_2O)_6]^{+2}$ નો શોપણ વાર્ષિક સમજાવો.

7

7

(B) નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો : (કોઈપણ ચાર)

4

- (1) $[Mn(H_2O)_6]^{+2}$ સંકીર્ણ શાથી આછો ગુલાબી રંગ દર્શાવે છે ?
(2) 2p ટર્મ સંજ્ઞામાં '2' શું દર્શાવે છે ?
(3) 'd' કક્ષકોના વિભાજનમાં કયા પરિબળ અસર કરે છે ?
(4) d-d વાર્ષિક શાથી ચાનિ દુર્ભાગી અને અસંમિતિય હોય છે ?
(5) હિલીયમ પરમાણુ (He) ની નિભન્તમ ઉત્તેજીત અવસ્થા માટેની ટર્મ સંજ્ઞા કઈ હશે ?
(6) સ્પીન ગુણાંક અને અધ્યુભૂત ઈલેક્ટ્રોનની સંખ્યા વચ્ચેનો સંબંધ દર્શાવો.

2. (A) હાઈડ્રોજન પરમાણુ માટેનું શ્રોડિંજર સમીકરણ પ્રુવિય સ્વરૂપમાં લખો અને તેમાંથી $\phi - \text{સમીકરણ}$ અલગા કરો. સ્વીકાર્ય $\phi - \text{સમીકરણ}$ માટેનો હલ અચળાંક $m = 0, \pm 1, \pm 2, \pm 3, \dots$ તરફ દોરી જાય છે તે સમજાવો.

14

અધ્યવા

- (i) કારકનો હરમિશીયન ગુણધર્મ સમજાવો. સાબિત કરો કે હરમિશીયન કારકના આયગન મૂલ્યો હંમેશા વાસ્તવિક હોય છે.
(ii) નીચેના તરંગ કલન માટે સામાન્યીકૃત અચળાંક મેળવો :

7

7

$$\Psi = A \sin \frac{n\pi}{a} x, \text{ જ્યાં } 0 \leq x \leq a.$$

- (B) નીચેનામાંથી કોઈપણ ચાર પ્રશ્નોના જવાબ એક વાક્યમાં લખો : 4
- ધન પેટીમાં રહેલા કાણ માટે શૂન્ય હિંદુ શક્તિનું મૂલ્ય દર્શાવો.
 - હરમિશીયન કારકનું કોઈપણ ઓક ઉદાહરણ આપો.
 - ઓર્થોગોનલ તરંગ ફલનો એટલે શું ?
 - શ્રોડિન્જર સમીકરણનું હેમિલોનીઅન સ્વરૂપ લખો.
 - આયગન મૂલ્ય સમીકરણ કોને કહેવામાં આવે છે ?
 - જડ-ભામક પ્રણાલીનો કોઈપણ એક ઉપયોગ લખો.
3. (A) નીચેનું સેક્યુલર સમીકરણ ઉપજાવો : 14
- $$\begin{bmatrix} H_{11} - ES_{11} & H_{12} - ES_{12} \\ H_{21} - ES_{21} & H_{22} - ES_{22} \end{bmatrix} = 0$$
- અથવા
- સંકરણ એટલે શું ? sp^2 સંકૃત કક્ષક માટે તરંગ વિધેય ઉપજાવો. 7
 - ઇથીલીન આણ માટે સાઢો હુકેલનો સિદ્ધાંત સમજાવો. 7
- (B) નીચેનામાંથી કોઈપણ ત્રણ પ્રશ્નોના જવાબ એક વાક્યમાં લખો : 3
- ચલ પ્રમેયનો ઉપયોગ શું છે ?
 - sp^3 સંકૃત કક્ષકો વચ્ચેનો બંધ કોણ આપો.
 - H_{11} શું દર્શાવિ છે ?
 - એલાયલીક કાર્બ્ઝ-કેટાયનમાં π -ઇલેક્ટ્રોનની સંખ્યા લખો.
 - એલાયલીક મુક્ત આયનની ડિલોકેલાઈજડ (DE) નું મૂલ્ય લખો.
4. (A) ધાતુ—કાર્બોનિલ સંયોજનોના બંધારણ નક્કી કરવા માટે IR વર્ણિપત્રની ઉપયોગીતા ઉદાહરણ સહીત સમજાવો. 14
- અથવા
- કાર્બ્ઝ-ધાત્વિય સંયોજનોની વ્યાખ્યા આપી તેઓનું વર્ગીકરણ કરો. 7
 - $Mn_2(CO)_{10}$ અને $Co(CO)_3NO$ ના આધુનિક કક્ષક આવેખ દોરો. 7
- (B) નીચેનામાંથી કોઈપણ ત્રણ પ્રશ્નોના જવાબ એક વાક્યમાં આપો : 3
- કાર્બ્ઝ ધાત્વિય સંયોજનો એટલે શું ?
 - $Fe_2(CO)_9$ માં કેટલા ભીજ કાર્બોનિલ છે ?
 - નાઈટ્રીક ઓક્સાઈડ (NO) લિગેન્ડ કેટલા ઇલેક્ટ્રોન 'd' કક્ષકોને આપે છે ?
 - અસરકારક પરમાણુ કમાંક એટલે શું ?
 - $(C_5H_5)_2Fe$ નું બંધારણ દોરો.

Seat No. : _____

OC-130

October-2018

B.Sc., Sem.-VI

308 : Chemistry
(Inorganic)

Time : 2:30 Hours]

[Max. Marks : 70

1. (A) Derive the ground state term symbol for the following : 14

- (a) F⁻¹ (Z = 9) (b) Sc²⁺ (Z = 21)
(c) S (Z = 16) (d) Ni²⁺ (Z = 28)

OR

- (i) Draw the Pigeon hole diagram for d² configuration and derive all term symbols for it. 7
(ii) Explain the absorption spectrum of [Cu(H₂O)₆]⁺². 7

- (B) Answer the following in one word or a sentence. (any four) 4

- (1) Why does [Mn(H₂O)₆]⁺² gives light pink colour ?
(2) What does '2' indicates in the term symbol 2p ?
(3) Which factors affect the splitting of 'd' orbitals ?
(4) Why the d-d spectra is very weak and unsymmetrical ?
(5) What will be the term symbol for the lowest excited state of the helium atom ?
(6) What is the relationship between spin multiplicity and number of unpaired electrons ?

2. (A) Write the Schrodinger wave equation for H-atom in polar form and separate the ϕ -equation. Explain how this ϕ -equation leads to $m = 0, \pm 1, \pm 2, \pm 3, \dots, \infty$. 14

OR

- (i) Explain the Hermitian property of an operator. Prove that eigen values of Hermitian operators are always real. 7
(ii) Obtain the Normalization Constant for the following wave function : 7

$$\Psi = A \sin \frac{n\pi}{a} x, \text{ where } 0 \leq x \leq a.$$

(B) Answer the following questions in one sentence only. (any four) 4

- (1) Give the zero point energy of an electron moving in a cubical box.
- (2) Give any one example of Hermitian operator.
- (3) What are orthogonal wave functions ?
- (4) Write the Hamiltonian form of Schrodinger equation.
- (5) What is an eigen value of equation ?
- (6) Give one application of the studies of rigid rotator.

3. (A) Obtain the following secular equation : 14

$$\begin{bmatrix} H_{11} - ES_{11} & H_{12} - ES_{12} \\ H_{21} - ES_{21} & H_{22} - ES_{22} \end{bmatrix} = 0$$

OR

- (i) What is hybridization ? Obtain the wave function for sp^2 hybrid orbital. 7
 - (ii) Explain the Simple Huckel theory for ethylene molecule. 7
- (B) Answer the following any three questions in one sentence. 3
- (1) What is the use of variation principle ?
 - (2) Give the bond angle between sp^3 hybrid orbitals.
 - (3) What does H_{11} indicates ?
 - (4) Write the no. of π -electrons in allylic carb cation.
 - (5) Give the delocalized energy (DE) of an allylic free radical.

4. (A) Discuss the application of IR spectra in the determination of structures of metal carbonyls by taking suitable examples. 14

OR

- (i) Define the term organometallic compounds and give their classification. 7
 - (ii) Draw the recent orbital diagrams of $Mn_2(CO)_{10}$ and $Co(CO)_3NO$. 7
- (B) Answer any three of the following questions in one sentence. 3
- (1) What are organometallic compounds ?
 - (2) How many bridging carbonyl groups are there in $Fe_2(CO)_9$?
 - (3) How many electrons are donated by NO ligand to the valency system of d orbitals ?
 - (4) What is Effective Atomic Number Rule ?
 - (5) Draw the structure of $(C_5H_5)_2Fe$.

Seat No. : _____

AC-116

April -2018

B.Sc., Sem.-VI

CC-308 : Chemistry
(Inorganic Chemistry)

Time : 3 Hours]

[Max. Marks : 70

- સૂચના : (1) દરેક પ્રક્રિયા ગુણ સરખા છે.
(2) જમણી બાજુના અંક પ્રક્રિયા ગુણ દર્શાવે છે.

1. (a) L-S સંયોજન સમજાવી તેના આધારે ધરાસ્થિતિની ટર્મસંક્રાનકી કરવાના નિયમો લખો. 7
અથવા

નીચે દર્શાવિલ પદ માટે ટર્મ સંક્રાન્સો મેળવો :

- (i) Ni^{2+} ($Z=28$)
(ii) S ($Z=16$)
(iii) O^{2-} ($Z=8$)

- (b) d^1 અને d^9 રૂચના માટે ઓર્ગાનિક આઈટિ સમજાવો. 7
અથવા

$[\text{Ni}(\text{H}_2\text{O})_6]^{2+}$ ના અવશોધણ પદ્ધતિમાં ત્રણ પદું જોવા મળે છે. સમજાવો.

2. (a) સાબિત કરો કે હર્ષિશીયન કારકના આયગન મૂલ્યો વાસ્તવિક હોય છે. 7
અથવા

શૂન્ય બિંદુ શક્તિ સમજાવો.

- (b) ત્રિપરિમાળીય પેટીમાં રહેલા કણ માટેનું શક્તિનું સમીકરણ મેળવો. 7
અથવા

દર વામક સમજાવો.

3. (a) $\text{H}_2\text{C} = \text{CH}_2$ આણુ માટેનો હુકૂલ પ્રમેય સમજાવો. 7
અથવા

સંકરણ એટલે શું? sp^2 સંકર કક્ષકોના તરંગ વિધેય ઉપજાવો.

- (b) ન-પરમાળુક આણુ માટે સેક્યુલર સમીકરણ ઉપજાવો. 7
અથવા

હુકૂલના આલ્યુનિક કક્ષકવાદ સિદ્ધાંત ઉપર નોંધ લખો.

4. (a) $\text{Ni}(\text{CO})_4$ અને $\text{Co}_4(\text{CO})_{12}$ ની સરચના ચર્ચો.

7

અથવા

ધાતુ કાર્બોનિલ સંયોજનોમાં IR વર્ણપત્રનું મહત્વ સમજાવો.

- (b) એલ્યુમિનિયમ (Al) ના કાર્બધાત્ત્વિય સંયોજન ઉપર નોંધ લખો.

7

અથવા

ફેરોસીનનું બંધારણ ચર્ચો.

5. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો :

14

- (1) L-S સંયુક્તિકરણ અને J-J સંયુક્તિકરણ વચ્ચે એક તકાવત જણાવો.
- (2) ટર્મ સંકાની વ્યાખ્યા આપો.
- (3) $[\text{Mn}(\text{H}_2\text{O})_6]^{2+}$ નો રંગ શા માટે આછો ગુલાબી હોય છે ?
- (4) સ્પેક્ટ્રોક્રીકલ શૈલી લખો.
- (5) ડીજનરેસી એટલે શું ?
- (6) ઓર્થોગોનલ તરંગ વિધેયની શરૂત જણાવો.
- (7) d-d સંકાતિ માટેનો એક નિયમ લખો.
- (8) ચલાયમાન રીતનો સિદ્ધાંત આપો.
- (9) sp સંકૃત કક્ષાનો વચ્ચેનો ભૂણો જણાવો.
- (10) એલાઈલ મુજાન મુલકમાં π-ઇલેક્ટ્રોનની સંખ્યા લખો.
- (11) ધાતુ કાર્બોનિલ સંયોજનની વ્યાખ્યા આપો.
- (12) કાર્બોનિલ હાઈડ્રાઇડ સંયોજનનું એક ઉદાહરણ આપો.
- (13) $\text{Fe}_2(\text{CO})_9$ માં આવેલા સેતુચુક્ત બંધ દર્શાવતા કાર્બોનિલ (CO) સમૂહની સંખ્યા લખો.
- (14) કાર્બધાત્ત્વિય સંયોજન (OMC) એટલે શું ?

Seat No.: _____

AC-116

April -2018

B.Sc., Sem.-VI

CC-308 : Chemistry
(Inorganic Chemistry)

Time : 3 Hours]

[Max. Marks : 70]

Instructions : (1) All questions carry equal marks.

(2) Figures to the right indicate full marks to the sub-question.

1. (a) Explain L-S coupling. Give the rules to decide the term symbol for the ground state according to this rule. 7

OR

Derive the ground state term symbol for the following :

(i) Ni^{2+} ($Z=28$)

(ii) S ($Z=16$)

(iii) O^{2-} ($Z=8$)

- (b) Explain : Orgal diagram of $d^1 - d^9$ system. 7

OR

Explain the electronic band of $[\text{Ni}(\text{H}_2\text{O})_6]^{2+}$ has three peaks.

2. (a) Prove that eigen values of a Hermitian operator are real. 7

OR

Explain Zero point energy.

- (b) Derive the energy equation of particle in three dimensional box. 7

OR

Explain the Rigid Rotator.

3. (a) Explain the simple Huckel theory for $\text{H}_2\text{C} = \text{CH}_2$. 7

OR

What is Hybridization? Obtain the wave function for sp^2 hybrid orbitals.

- (b) Explain the secular determinant for 'n-atomic' molecule. 7

OR

Write a note on The Huckel Molecular Orbital (HMO) Theory.

4. (a) Discuss the structure of $\text{Ni}(\text{CO})_4$ and $\text{Co}_4(\text{CO})_{12}$.

7

OR

Give the importance of IR spectra in Metal Carbonyl compound.

- (b) Give note on Organo metallic compound of Alumminium (Al).

7

OR

Discuss the structure of Ferrocene.

5. Answer the following question in brief :

14

- (1) Give one difference between L-S coupling and J-J coupling.
 - (2) Define : Term Symbol.
 - (3) Why the colour of $[\text{Mn}(\text{H}_2\text{O})_6]^{2+}$ is light pink ?
 - (4) Write spectrochemical series.
 - (5) What is degeneracy ?
 - (6) Give the condition of Orthogonal wave function.
 - (7) Write one rule for d-d transition.
 - (8) Give the Principle of Variation Method.
 - (9) Give the bond angle between sp hybrid orbitals.
 - (10) Write no. of π electron in allyl free radical.
 - (11) Define Metal Carbonyl compound.
 - (12) Give one example of Carbonyl Hydride compound.
 - (13) How many Bridge bonded CO groups present in $\text{Fe}_2(\text{CO})_9$.
 - (14) What is Organo Metallic Compound (OMC) ?
-